

ત્વરિત જાહેરાત માટે

## બ્રેમ્પટનનું ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ આર્થિક રિક્વરીમાં આગળ વધશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 4, 2020) – સીટી ઓફ બ્રેમ્પટન ડાઉનટાઉન બ્રેમ્પટનના હાર્ટમાં ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ બનાવી રહ્યું છે જે ગતિશીલ સ્ટાર્ટઅપ સમુદાયને પ્રોત્સાહન આપશે, સ્થાનિક પ્રતિભાઓ વિકસાવશે અને ધંધાકીય સાહસિકોને સહાયતા કરશે.

આગામી બુધવારે, બ્રેમ્પટનના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં નવા [રાયરસન વેન્યર ઝોન](#)ની ઔપચારિક શરૂઆત થશે. આ નવી ઈનક્યુબેટર સંસ્થા બ્રેમ્પટનમાં નવા ધંધાઓ ઊભા કરવામાં અને વિકસાવવામાં મદદ કરવા, ઉચ્ચ-આવડતોવાળી નોકરીઓ ઊભી કરવા, અને પ્રતિભા પાઈપલાઈન વિકસાવવા માટે સમર્પિત છે.

ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ શહેરની COVID-19 [ઈકોનોમિક રિક્વરી સ્ટ્રેટેજી](#)માં એક મુખ્ય પહેલ છે, અને તેનું આગામી મહિનાઓ અને વર્ષોમાં વિકસવાનું ચાલુ રહેશે.

### ઈનોવેશન ડિસ્ટ્રિક્ટના ભાગીદારો

રાયરસન વેન્યર ઝોન ઉપરાંત, સંખ્યાબંધ ધંધાકીય સાહસલક્ષી, ધંધાકીય પરિપક્વતા, અને પ્રવેગક સ્પેસીસ બ્રેમ્પટનના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં જોડાઈ છે, જેમાં સામેલ છે:

- [બ્રેમ્પટન એન્ટરપ્રિન્યુર સેન્ટર \(BEC\)](#) સહિયારી-કાર્યરત સ્પેસ અને નાના ધંધાકીય સંસાધનો - વિશાળ 4,500 સ્કવેર ફીટ સ્ટોરફ્રન્ટમાં સ્થિત, આ સહિયારી કાર્યરત સ્પેસની રચના ઈંધણ રચનાત્મકતા અને ઉત્પાદકતા માટે કરવામાં આવી છે. BEC અવારનવાર સેમિનારોનું આયોજન કરે છે અને ધંધાકીય સાહસિકો અને નવીન શોધકર્તાઓને સલાહકારો સાથે કોઈ ખર્ચ વગર ધંધાકીય આયોજન સમીક્ષાઓ અને સલાહ-મસલતો પૂરી પાડે છે.
- [કેટાલિસ્ટ સાર્થબર એક્સેલરેટર \(રોજર્સ સાર્થબર સિક્યુરિટી કેટાલિસ્ટ એન્ડ રાયરસન DMZ ની આગેવાનીમાં\)](#) - આ એક્સેલરેટર સ્ટાર્ટઅપ્સ અને સ્કેલ-અપ્સ માટે કેનેડાનું પ્રથમ સાર્થબર સિક્યુરિટી એક્સેલરેટર છે. આ એક્સેલરેટર, રોજર્સ સાર્થબર સિક્યુરિટી કેટાલિસ્ટના અન્ય કોર્નરસ્ટોન્સ સાથેના જોડાણમાં (કેનેડાનું પ્રથમ સાર્થબર રેન્જ, સાર્થબર સિક્યુરિટી ટ્રેઈનિંગ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સહિત) બ્રેમ્પટનને કેનેડાનું સાર્થબર સિક્યુરિટી હબ બનાવવાની સ્થિતિમાં લાવી રહ્યું છે.
- [રિસર્ચ ઈનોવેશન કોમર્સિયલાઈઝેશન \(RIC\) સેન્ટર](#) - એક ખાસ ધંધાકીય પરિપક્વતા અને પ્રવેગક સ્પેસ, RIC સેન્ટર સ્ટાર્ટઅપ્સને આગળ વધારવામાં અને તેઓના ધંધાઓને આગામી સ્તરે લઈ જવામાં મદદ કરે છે. RIC સેન્ટર ટેકનોલોજી કંપનીઓ માટે એક ગતિશીલ ઉદ્દીપક (ડાઈનેમિક કેટાલિસ્ટ) છે અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લીનટેક અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓ માટે ખાસ સંસાધનો ધરાવે છે.
- બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ એન્ડ ધી ડાઉનટાઉન બિઝનેસ ઈમ્પ્રુવમેન્ટ એરિયા (BIA) પણ ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ બનાવવામાં મુખ્ય ભાગીદારો છે.

વધુ ભાગીદારો આ વર્ષે આગળ ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં જોડાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

**પ્રતિભા વિકાસ**

ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ, ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) આસપાસની પ્રતિભાને આવડત વધારવા કે સુધારવાની શિક્ષણ અને તાલીમ તકો પણ આપે છે. રાયરસન યુનિવર્સિટી યાંગ સ્કૂલ ઓફ કન્ટિન્યુઇંગ એજ્યુકેશન એન્ડ રોજર્સ સાઈબર સિક્યુર કેટાલિસ્ટથી માંડીને, શેરિડેન કોલેજ અને અલ્ગોમા યુનિવર્સિટી સુધી, ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ પ્રતિભા વિકાસ માટે વિકસી રહેલું હબ છે.

**આર્થિક રિકવરી વ્યૂહરચના**

મે 13 નાં રોજ, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે સ્થાનિક અર્થતંત્ર ફરી શરૂ કરવા આગળ વધવા [ઈકોનોમિક રિકવરી સ્ટ્રેટેજી](#) મંજૂર કરી. આ વ્યૂહરચના પોતાના ચાર કોર્નર સ્ટોન્સ અનુસાર તાત્કાલિક અને લાંબા-ગાળાની ક્રિયાઓ આધુનિક બનાવીને બ્રેમ્પટનના અર્થતંત્રમાં સ્થિતિસ્થાપક અને સ્પર્ધાત્મક લાભ લાવવાનો હેતુ ધરાવે છે: નવીન શોધ, ટેકનોલોજી અને સાહસવૃત્તિ, રોકાણ, માળખાગત સગવડો, અને કળા, સંસ્કૃતિ અને પર્યટન.

**અવતરણો (ક્વોટ્સ):**

“બ્રેમ્પટન આપણાં શહેર અને સ્થળમાં કેનેડાના ઈનોવેશન કોરિડોરની મધ્યમાં મજબૂત ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ બનાવવા ઝડપથી આગળ વધી રહ્યું છે જે આપણને નવા રોકાણ માટે આદર્શ સ્થળ બનાવે છે. આપણું ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ પરિપક્વ બની રહ્યું છે ત્યારે, અમે ધંધાઓના પ્રવાસના દરેક તબક્કામાં સહાયતા પૂરી પાડી શકીશું.”

– *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“આપણાં ઈનોવેશન ડિસ્ટ્રિક્ટનો સતત વિકાસ આપણી આર્થિક રિકવરી વ્યૂહરચનામાં મુખ્ય કાર્યવાહી છે, અને રાયરસન વેન્યર ઝોન આપણાં વિકાસશીલ ડિસ્ટ્રિક્ટમાં મુખ્ય ઉમેરો છે. આપણે આપણાં શહેરને COVID-19 મહામારીમાંથી બહાર લાવી રહ્યાં છીએ ત્યારે, અમે આપણી ઈનોવેશન ઈકોસિસ્ટમ આધુનિક બનાવવા અને ઈનોવેશન ડિસ્ટ્રિક્ટને અજોડ બનાવવા સમર્પિત છીએ.”

– *પૉલ વિસેંટે (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; કો-ચેર (સહ-અધ્યક્ષ), મેયરનો COVID-19 આર્થિક સહાયતા ટાસ્ક ફોર્સ, સીટી ઓફ બ્રેમ્પટન*

“આપણે આ મહામારીમાંથી બહાર આવીને આપણું સ્થાનિક અર્થતંત્ર પુનઃશરૂ કરી રહ્યાં છીએ ત્યારે, આપણે ધંધાકીય સાહસિકો અને સંભવિત રોકાણકારોને આપણાં વિકાસશીલ ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં જોડાવવા આવકારીએ છીએ. બ્રેમ્પટન ધંધો સ્થાપવા માટે એક આદર્શ સ્થળ હોવાના ઘણાં કારણો છે, અને અમારી સાથે હિતધારકોને જોડાઈને પ્રવૃત્તમય થવા અને ગતિનો ભાગ બનવા અમે આશાવાદી છીએ.”

– *માઈકલ પાલેસ્ચી (Michael Palleschi), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6; કો-ચેર (સહ-અધ્યક્ષ), મેયરનો COVID-19 આર્થિક સહાયતા ટાસ્ક ફોર્સ, સીટી ઓફ બ્રેમ્પટન*

“કેનેડાના ઈનોવેશન કોરિડોરની મધ્યમાં આપણાં મુખ્ય સ્થળ વડે, બ્રેમ્પટન નવીન શોધમાં વૈશ્વિક આગેવાન બનવાના લક્ષ્ય સાથે પોતાની નવીન શોધ ઈકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે. અમારા કર્મચારીઓ ભાગીદારીઓ કરવા અને જરૂરી પરિસ્થિતિઓ સુલભ બનાવવા કટિબદ્ધ છે જેથી બ્રેમ્પટનને ધંધાકીય સાહસિકો અને ધંધાઓ માટે શ્રેષ્ઠ સ્થળ બનાવી શકાય.”

– *ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ



## Media Release

છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ.  
વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)